

Visit of the Prime Minister of Denmark to India (October 9-11, 2021)

October 12, 2021

ડેન્માર્કના વડાપ્રધાનની ભારતયાત્રા (ઓક્ટોબર 9-11, 2021)

ઓક્ટોબર 12, 2021

ડેન્માર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સને 9-11 ઓક્ટોબર 2021 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. કોવિડ-19 મહામારી શરૂ થઈ ત્યાર પછી કોઈ પણ સરકારના વડાની આ પ્રથમ ભારતયાત્રા હતી.

2. વડાપ્રધાન ફ્રેડરિક્સન સાથે સાથે ઉચ્ચ સ્તરીય અધિકારી અને વ્યવસાયિક પ્રતિનિધિમંડળ પણ સામેલ હતું. તેમના દ્વિવપક્ષીય આદાનપ્રદાનમાં વડાપ્રધાન ફ્રેડરિક્સને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. તેમણે ભારતના માનનીય રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. વિદેશમંત્રીએ પીએમ ફ્રેડરિક્સન સાથે વાત કરી હતી.

3. બંને વડાપ્રધાનો વચ્ચે દ્વિવપક્ષીય વાટાઘાટો ઉખાભર્યા અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી જે બંને દેશો વચ્ચે ગાઢ ભાગીદારી દર્શાવે છે. બંને પક્ષોએ ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં પ્રગતિની સમીક્ષા કરી હતી જે સપ્ટેમ્બર 2020માં યોજાયેલી વર્ચ્યુઅલ સમિટ દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી.

4. મુલાકાત દરમિયાન બંને દેશોએ કૃષિ ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગને વધુ વિસ્તૃત કરવાનું નક્કી કર્યું હતું, જેમાં કૂડ સેફ્ટી, કોલ્ડ ચેઇન, કૂડ પ્રોસેસિંગ, ફર્ટિલાઇઝર્સ, ફિશરીઝ, એકવાકલ્યર વગેરે ક્ષેત્રોમાં સહકારના નવા ક્ષેત્રો જેવા કે સ્માર્ટ વોટર રિસોર્સ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. તેમાં વેસ્ટ ટુ બેસ્ટ- કચરામાંથી શ્રેષ્ઠ સંસાધનોનું સર્જન અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટની પણ ઓળખ કરવામાં આવી હતી. બંને પક્ષોએ આરોગ્ય ક્ષેત્રે સહકારને આવકાર્યો હતો.

5. બંને નેતાઓએ પવન અને સૌર, પાણી, શિપિંગ અને બંદરો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક અર્થતંત્ર સહિત નવીનીકરણીય ઊર્જા જેવા ક્ષેત્રોમાં ગ્રીન ટેકનોલોજી અને કાયમી ઉકેલોમાં ચાલી રહેલી ભાગીદારીની પ્રશંસા કરી હતી. ભારતમાં હાજર 200થી વધુ ડેનિશ કંપનીઓ મેક ઈન ઈન્ડિયા, જલ જીવન મિશન, ડિજિટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, નમામિ ગંગે વગેરે ભારતના મુખ્ય રાષ્ટ્રીય મિશનને આગળ વધારવામાં સક્રિયપણે સામેલ છે.

6. બંને વડાપ્રધાનોએ રોગચાળા પછીની વૈશ્વિક આર્થિક પુનરિકવરીપ્રાપ્તિ, ઈન્ડો-પેસિફિક અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની પણ ચર્ચા કરી. બંને નેતાઓએ ભારત-ઈયુ એફટીએ વાટાઘાટો ફરી શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો અને આશા વ્યક્ત કરી કે તેઓ વહેલી તકે પૂર્ણ થશે.

7. આ મુલાકાત દરમિયાન પરંપરાગત જ્ઞાન, કૌશલ્ય વિકાસ, ભૂગર્ભ જળ સંસાધનોનું મેપિંગ અને કુલન્ટ ટેકનોલોજીના

ક્ષેત્રોમાં સરકારથી સરકાર વચ્ચે ચાર એમઓયુ અને કરારોની આપલે કરવામાં આવી હતી. આ ઉપરાંત, મુલાકાત દરમિયાન ત્રણ વ્યાપારી કરારો પણ કરવામાં આવ્યા હતા.

8. પીએમ ફેડરિક્સેને પીએમ મોદીને 2022માં બીજી ઈન્ડિયા-નોર્ડિક સમિટ માટે કોપનહેગન આવવાનું આમંત્રણ આપ્યું હતું. માનનીય રાષ્ટ્રપતિએ ડેનમાર્કની મહારાણી મહારાણી માર્ગરિટ દ્વિવતિયને આગામી વર્ષે ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.

9. ભારતની મુલાકાત દરમિયાન પીએમ ફેડરિક્સેને આગ્રા અને ગરવી ગુજરાત ભવનની મુલાકાત લીધી હતી જ્યાં તેમને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક મળી હતી. તેમણે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને ક્વાઈમેટ ચેન્જ સામે લડવા માટે નજીકના સહયોગના મહત્વ પર આયોજિત કાર્યક્રમમાં વિશેષ સંબોધન કર્યું હતું.

10. તેમણે નવી દિલ્હીમાં કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ સાથે પણ વાતચીત કરી હતી જ્યાં તેમને અટલ ઈનોવેશન લેબ જોવાની તક મળી હતી.

નવી દિલ્હી

ઓક્ટોબર 12, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.